https://archive.org/details/bk1053/page/n0/mode/1up
-KotdaJ Minutes -Last 12 yearly marriage (1053)
All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

KJ-BK-4-15

[illegible] ૨૦૦૨ ના કારતક સુદ ૧૦ ને ગુરુવાર ના રોજ શ્રી કડવા પાટીદાર ભાઈઓ જુદા જુદા ગામ ના માત્ર ગામના પ્રતિનિધિઓ (આશરે ગામ ૬૦ ના [illegible] ભાઈઓ) ની જાહેર સભા શ્રી કોટડા જાહેર મુકામે ઉપર જણાવેલ સમયના [illegible] દિવસના સા. ૯ વાગે એકત્ર થયેલ હતા. તે તે સભામાં થયેલ કામ કાજ ની વિગત નીચે મુજબ

સભાના પ્રમુખ સૂરત સનાતન સમાજ ના પ્રમુખ શ્રી. શ્રી યુત રતનશીભાઈ ભીમજી બિરાજેલ હતા.

અને નીચે જણાવેલ ભાઈઓએ પ્રવચનો કર્યા હતા.

(૧) આજની સભાનો ઉદ્દેશ જણાવવા શ્રીયુત નથુભાઈ નાનજી ઉભા થયા હતા અને સભા એકત્ર થવાનું કારણ સમજાવેલ હતું અને સંવત ૨૦૦૧ ના આસો વદ ૧૪ થી સંવત ૨૦૦૨ ના કારતક સુદ ૧૦ સુધીનો કાર્યવાહક કમીટીના ભાઈઓએ જે પ્રચાર કાર્ય અને કુરિતિ રીત સંબંધીના કાર્યો જે કરેલ તે બધાનો વિગતવાર અનુક્રમે નોંધ. વાંચી સંભળાવેલ હતા. તે બાદ પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજીએ આપણા સમાજમાં જેટલા સુધારાઓ અને તેના માટે કેવી જાતના કુરિવાજો કાઢવાના છે એ સંબંધી સચોટ રીતે દીલને પીગળાવી નાખે એ રીતે પોતાના હૃદય સ્પર્શી વિચારો રજુ કરેલ હતા. અને સમાજને પડકાર કરેલ હતો કે કોઈ પણ લોકો તાત્કાલિક આવા જાતના [illegible] બાબતો દરેકે સ્વયં પુર્ણ સાહસ સહકાર દે. એકત્ર થઈ સમાજમાં ખુબ પ્રચાર કરી સમાજને જાગૃત કરવા અને કાર્યકર્તા સમાજના કાર્યકરોને પુર્ણ રીતે તન, મન અને ધન દે. સાથ આપવા સૂચના આપી હતી.

(૨) અને તેના અનુસંધાનમાં ~~[illegible]~~ સભા ના પ્રમુખે પણ પોતાને ફાળે તરફ દે. જે કાર્ય તેમને તેઓએ સમસ્ત કુરિવાજ. કાઢવા રહ્યા છે તેમાં સમાજના ભાઈઓ તરફ દે. તેમને ખુબ સાથ અને સહકાર મળેલ છે જે બદલ તેઓએ તેમના પ્રત્યે આભાર દર્શાવેલ હતો અને વધુમાં જણાવેલ કે આપણો [illegible] રહે. આપણે રહેત. સમાજને જાગૃત કરવામાં પ્રચાર થયેલ. જે જાગૃતિનો પડકાર સમાજે સારી રીતે પચાવી જાણેલ છે પરંતુ પ્રચાર કાર્યને માટે અને આપણા સમાજ ના સાથે જે ભેદો રહેલા છે તેના ઉપર સારી રીતે લોકો આપવાની જરૂરિયાત છે અને તે લોકો આપવાને માટે જે ભાઈઓ તૈયાર હોય તેમનાં જાહેર રીતે નામો જણાવવા અપીલ કરી હતી.

(૩) અને ત્યાર બાદ શ્રીયુત નથુભાઈ નાનજી એ ઘણી જોર રીતે તેઓના કાર્યોમાં સારી રીતે સાથ અને સહકાર ઉપરે ભાવનાપૂર્વકી રીતે આપવા વિનંતી કરી હતી. અને સભાની અંદર જે ઠરાવો કરવાના વિચારણા કરવાના

realpatidar.com

https://archive.org/details/bk1053/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4, 5.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1053/page/n2/mode/1up
-KotdaJ Minutes -Last 12 yearly marriage (1053)
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:34:30 +05'30'
Real Patidar Unravel Truth

KJ-BK-4-15

VSAK: 15-Nov-1945

realpatidar.com

શંવત ૨૦૦૨ ના કારતક શુદ ૧૦ ને ગુરૂવાર ના રોજ શ્રી કરછ કડવા પાટીદાર
ભાઈઓ જુદા જુદા ગામ ના માત્ર ગામના પ્રતિનિધિઓ (આશરે ગામ ૬૦ ના
પ્રતિનિધિ ભાઈઓની જાહેર સભા શ્રી કોટડા જડોદર મુકામે ઉપર જણાવેલ તારીખ
ના રોજે સવારના ક. ૯ વાગે એકત્ર થએલ હતા. ને તે સભામાં થએલ કામ
કાજની વીગત નીચે મુજબ

સભાના પ્રમુખ સૂરાંગ સનાતન સમાજના પ્રમુખ શ્રી. શ્રી યુત રતનશીભાઈ
ખીમજી બીરાજેલ હતા.

અને નીચે જણાવેલ ભાઈઓએ પ્રવચનો કર્યા હતા.

VSK: 20-Oct-1945

(૧) આજની સભાનો ઉદ્દેશ જણાવવા. શ્રીયુત નથુભાઈ નાનજી ઉભા થયા હતા
અને સભા એકત્ર થવાનું કારણ સમજાવેલ હતું અને શંવત ૨૦૦૧ ના આસો

VSAK: 15-Nov-1945

વદ ૧૪ થી સંવત ૨૦૦૨ ના કારતક શુદ ૧૦ સુધીનો કાર્ય પાડક ફેલાવનાભાઈઓ
એ જે પ્રચાર કાર્ય અને કુરિવાજ સંબંધીના કાર્યો જે કરેલ તે વગેરેના
વીગતવાર અનુક્રમે નોંધ. વાંચી સંભળાવેલ હતા. તે બાદ કુચ્છ મહારાજશ્રી
અધિપરામજીએ આપણા સમાજમાં કેટલા સુધારાઓ અને તેના માટે
કેવા પ્રકારના કુરિવાજો કાઢવાના છે તે સંબંધી સચોટ રીતે દીલને પાગળ
વી નાખે એ રીતે પોતાના હૃદય દ્રાવક વિચારો રજુ કરેલ હતા. અને સમાજને
પડકાર કરેલ હતો કે કોઈ પણ લોકો તાલુકાના. આપી ભતના આગરરીત
આપતા હરેક એવી પુરી સારસ સહકાર છે. એકત્ર થઈ સમાજમાં મુજબ
પ્રચાર કરી સમાજને જાગૃત કરવા અને કાર્યકર્તા સમાજના કાર્યો રીતે
પુર્ણરીતે તન, મન અને ધનથી. સાથ આપવા સુચના આપી હતી.

(૨) અને તેના અનુસંધાનમાં ~~પ્રમુખ~~ સભાના પ્રમુખે પણ પોતાને ફાળ લસકી.
જે કાર્ય નેમજી ભાઈઓ સમસ્ત કુરિવાજ ડાંગી રહ્યા છે તેનાં સમાજના ભાઈઓ
તરફથી. તેમને પુષ્કળ સાથ અને સહકાર મળેલ છે જે બદલ તેઓએ
તેમના પ્રત્યે આભાર દર્શાવેલ હતો અને વધુમાં જણાવેલ કે આપણાપણ
સદ્. આપણે કેટલ. સમાજને જાગૃત કરવામાં ખુબ સફળ. જે જાગૃતીનો
પડકાર સમાજે સારી રીતે ઝીલી લીધેલ છે પરંતુ પ્રચાર કાર્યને માટે
અને આજના સમાજના સાથે જે પ્રશ્નો રહેલા છે તેના અંદર સારી રીતે
લોકો આપવાના જરૂરીયાત છે અને તે લોકો આપવાને માટે કેટલા ભાઈઓ
તૈયાર હોય. તેમનાં જાહેર રીતે નામો જણાવવા અપીલ કરી હતી.

(૩) અને ત્યારબાદ શ્રીયુત નથુભાઈ નાનજીએ પણ એજ રીતે તેઓના
કાર્યોમાં સારી રીતે સાથ અને સહકાર ઉપર ભાવપૂર્વક રીતે આપવા
વિનંતી કરી હતી. અને આગામી અંદર જે ફરજીયાત કરવાની વિચારણા કરવાની

realpatidar.com

KJ- BK- 4-16

realpatidar.com

હતા. તેનો ફાયદો ખરો રજુ કરેલ હતો અને તે પ્રમાણે [illegible] નામે મુજબ ના. પ્રિન્સીપાલનો પ્રસ્તાવ રજુ કર્યો હતો

(૧) [illegible] સનાતનીઓએ નહી કરેલ લગ્ન, હિન્દુ સનાતન ધર્મ સમાજે છોડે કેમ. અગર જો તેમ હોય તો તે બાબતમાં શું કરવું

(૨) સુધારક ધર્મ માર્ગના યોજના.

(૩) કાર્યવાહક કમીટીના નવી ભરતી અને તેના સભાસદો

(૪) બાળ લગ્ન સંબંધમાં જે સગપણો છે તે સંબંધમાં સુધારો વધારો

(૫) ફંડ એકઠું કરવા માટે સંયુક્ત વ્યવસ્થા [illegible] યોજના ઘડવા. કરવી

(૬) સમાજનો બંધારણ ઘડી વધારવા યોજના.

ઉપર મુજબ. [illegible] રજુ કરવામાં આવી હતી. ~~[illegible]~~ [illegible] અને [illegible] સમાજ કાર્યમાં આવવાને માટે [illegible] [illegible] પટેલ [illegible] મુજબ કાર્યમાં આવવાને માટે [illegible] હોય તેઓના નામ [illegible] હતા. જે [illegible] નામે [illegible] પટેલ [illegible] કરવા મુજબ [illegible] હતા.

સહી

૪ (૧) પટેલ [illegible] સાધુ.

૧ (૨) [illegible]

૩ (૩) ડૉ. ગંગારામભાઈ [illegible]

૨ (૪) પટેલ નથુભાઈ નારણ

૫ (૫) પટેલ [illegible]

(૬) પટેલ [illegible]

(૭) પટેલ [illegible] ગોપાલ દુર્ગાપુર

(૮) [illegible]

(૯) પટેલ [illegible] } [illegible]

(૧૦) પટેલ [illegible]

(૧૧) પટેલ [illegible]

(૧૨) પટેલ [illegible] ([illegible]). [illegible]

(૧૩) પટેલ [illegible]

(૧૪) પટેલ [illegible]

(૧૫) પટેલ [illegible]

(૧૬) પટેલ [illegible]

(૧૭) પટેલ [illegible]

(૧૮) પટેલ [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1053/page/n4/mode/1up

-KotdaJ Minutes -Last 12 yearly marriage (1053)

KJ-BK-4-17

realpatidar.com

(૧૯) પટેલ વિશરામભાઈ લધા. વેરસલપર
(૨૦) પટેલ માવજીભાઈ નાનજી ઉખેડા.
(૨૧) પટેલ રામજીભાઈ ધરમા ગઢશીશા
(૨૨) પટેલ હીરજીભાઈ લાલજી કોટડા જડોદર
(૨૩) પટેલ નાનજીભાઈ કેશરા કોટડા જડોદર
(૨૪) પટેલ અરજણભાઈ પરબત. વિરાણી.
(૨૫) પટેલ લધાભાઈ વિશરામ. વિરાણી.
(૨૬) પટેલ શીવજીભાઈ મેઘજી આથમણા
(૨૭) પટેલ નારાણજીભાઈ કેસરા આનંદપર
(૨૮) પટેલ લાલજીભાઈ શીવગણ કોટડા. આથમણા
(૨૯) પટેલ પચાણ શીવજી કોટડા જડોદર
(૩૦) પટેલ શીવજી પુંજા કોટડા જડોદર
(૩૧) પટેલ નનજીભાઈ રતનજી "
(૩૨) પટેલ શીવજીભાઈ નાનજી પરાવડા.
(૩૩) પટેલ હીરાજી પચાણ. પરાવડા આથમણા

તે જમાનામાં ૧૨ વર્ષે એક વખત લગ્ન થતાં. ક.ક.પા. જ્ઞાતિમાં આ છેલ્લા ૧૨ વર્ષીય લગ્ન હતાં

ઉપર મુજબ. નમારક આગેવાનોએ પતિયાના નામો સ્વરહસ્તે આપ્યાં હતાં ને તે ઉપર લગ્ન સંબંધી વિચાર ચલાવો આવી હતી. જે ચોરાણાં સતપંથ આગેવાનોએ જે લગ્ન. બાલારોપ. નક્કી કરી છે એના માટે આ પણ સમાજને તે વાત બંધ બેસતી છે કે કેમ. એનો ન્યાય માત્ર. ગામના આગેવાનો ને જુદી જુદી રીતે પુછવામાં આવ્યો હતો તેના. જવાબમાં માત્ર ગામના આગેવાનોએ પોતાના સતપંથ આગેવાનોએ જે વિચાર કરેલ કામ. નક્કી કરાયું છે તેના માટે વિરૂધ. દર્શાવ્યો હતો ~~[illegible]~~ વિચાર. જે ઉપરથી. લગ્ન. કઈ સાલમાં નકી કરવાં અને કઈ સાલે કરવાં ત્યા તેના અંદર કયા પ્રકારના ભેળસેળ કરવા. તે સંબંધમાં વિચાર ચલાવવા માટે નામે જણાવેલા આગેવાનોની સમિતિ. નીમવામાં આવી હતી.

realpatidar.com

KJ-BK-4-18

realpatidar.com

ઉપર જણાવેલ બાબતોનો વિષય ધ્યાનમાં લઈ કમિટિ. સર્વે સભ્યોએ મળી બહુમતે. એજન્ડા અંદર જણાવેલ બાબતોનું કાર્ય હાથ ધરવાનું આવ્યું હતું અને તે આંકડી પસાર કરવામાં આવ્યો જે મુજબ છે

(૧) આપણી જ્ઞાતિના. બાળકો (છોકરાઓ તથા છોકરીઓનાં (લગ્ન.).

(૧) ચાલુ સાલના ચૈત્ર વદ ૭ ને રવિવારના લગ્ન લખવા

લગ્ન લખવાં VSAK: 14-Apr-1946

(૨) ચૈત્ર વદ ૧૨ ને શુક્રવારના માંડવા રાખવા સવારનાં ૭ા થી ૧૦ા.

માંડવો VSAK: 19-Apr-1946 ટાઈમ સવારના ૭:૩૦ થી ૧૦:૩૦

(૩) ઉપર જણાવેલા દીવસે તથા ઉપર જણાવેલા ટાઈમે સવારનાં ગાઠેશળા સુધીમાં માણેક સ્તંભ ઈત્યાદિ બાબતોમાં રોપવો

(૪) ચૈત્ર વદ ૧૪ ને રવિવાર. મીઠા મોંનું જમણ.

મીઠાં મો: VSAK: 21-Apr-1946

(૫) ચૈત્ર વદ ૦)) ને સોમવાર. ગોતીડાં

ગોતીડાં: VSAK: 22-Apr-1946

(૬) ચૈત્ર સુદ ૧ ને મંગળવારના દીવસના બપોરના ૧ા વાગ્યાથી. રાત. સુધી ફેરા.

ફેરા: VSAK: 23-Apr-1946 ટાઈમ: બપોરે 01:30 થી આખી રાત

(૭) લગ્નમાં. આવનાર જાનૈયાઓને ટંક ત્રણ જમાડવા અને લગ્નમાં આવનાર માણસોની સંખ્યા. ૧૦ ઉપર. આવવાને બંધી છે.

જાનને માત્ર ૩ ટાણા જમાડવા

જાનમાં ૧૦ જણા થી વધુ આવી ના શકે

~~તે~~ તે સિવાય લગ્નની અંદર ભેળાફેળ કઈ રીતે કરવાનો ઠરાવ પાટીદાર મુકામે સંવત ૨૦૦૧ના આસો વદ ૦))ના દિવસે કરેલ છે જેથી શાખે. છપાવીને ગામો ગામ તે વાંચવામાં. મોકલી આપેલ છે તે પ્રમાણે ભેળાફેળ પ્રચાર કરવાનો છે

VSAK: 20-Oct-1945

તિથીએ

ઉપર જણાવેલ. તિથિએ આપણા સનાતન સમાજના. જે છોકરા અને છોકરીઓ છે અને જેનાં સગપણો સનાતન સમાજના બાળકોએ આપસ આપસમાં કરેલાં છે તેવા સૌ છોકરાઓ અને છોકરીઓના લગ્ન. ઉપર જણાવેલ તારીખે કરવાનાં છે પરંતુ. જે છોકરાઓના સગપણ પોતાના સંબંધ. બાબત બાળકોના છોકરાઓ વેરે થયેલાં હોય. અને પોતાના સંબંધ બાબતે ઉપર જણાવેલ તારીખે પોતાના છોકરાનાં લગ્ન. કરવા માટે વાંધો છે અગર નાપાડે તો અમોને પોતાના છોકરાનાં લગ્ન. જે રાખે કરી આપવા. પોતાના પુરત બતાવે તો રાખીને આપણા છોકરાઓનાં લગ્ન. કરી લેવાના છે ઉપર જણાવેલા લગ્નમાં આપણી જ્ઞાતિના. બાળકો પોતાના છોકરાના ઉમર પાંચ પરણાવવા. આઠથી. ઈચ્છા ન જણાય અને પાંચ. વરસથી. અધિક ઉમર ના. છોકરા ના લગ્ન. કરનાર. બાળ સમાજનો ગુન્હેગાર ગણાશે અને તેવો ગુન્હો કરનાર બાળકોને માટે સમાજ પંચ મળી જે સજા ફરમાવશે તે તેને કબુલ કરવી પડશે

realpatidar.com

https://archive.org/details/bk1053/page/n6/mode/1up

KJ- BK - 4 - 19

realpatidar.com

સનાતન સમાજના. ભાઈઓએ પોતાના. છોકરાઓ અગર છોકરીઓ
નાં લગ્ન. અઢાર વર્ષે કરવા. કોઈપણ ભાઈના છોકરાનું વેવિશાળ. પારણા
ઝુલાવતાં ત્યાં ચાલીસ ઉંમર સો છોકરા લેવાના. તે ચાલી કે રીતે
લગ્ન કરી આપે તે રીતે લગ્ન કરી લેવાની છૂટ આપવામાં આવે છે.
ઉપર પ્રમાણે લગ્ન સંબંધીના. ઠરાવ મંજુર થયા બાદ. નવા ઠરાવના.
કારોબારી. માટે નીચે પ્રમાણે ભાઈઓના. હોદ્દેદારો તરીકે ચુંટણી કરવામાં
આવી હતી.

(૧). પ્રમુખ. શ્રીયુત રતનશીભાઈ પ્રેમજી વિરાણી.
(૨). ડૉ. ગંગાદાસભાઈ વિરરામ. ઉંઝા. ઉપપ્રમુખ.
(૩). સેક્રેટરી. શ્રીયુત. નથુભાઈ નાનજી નખત્રાણા
(૪). ખજાનચી. શ્રીયુત. ભીમજીભાઈ કુંવરા. કોટડા જડોદર.

ઉપર પ્રમાણેના હોદ્દેદારો ત્થા. વિષય વિચારણા સમિતિના. સભ્ય ભાઈઓ
ની. સભાએ નીચે મુજબ ઠરાવ નકી કરેલ હતો

(૧). સનાતન સમાજ ની. બોર્ડીંગ નખત્રાણા મધ્યે રાખવી
અને તેના માટે મકાન લઈ બોર્ડીંગ સંબંધીનું કાર્ય
કરવા માટે એક સેવા ભાવી. નામ નક્કી કરવા. કે જે સના
તન ધર્મના કાર્યો માટે આપણા. ભાઈઓના. રસોઈ વિગેરે
ની વ્યવસ્થા. કરી શકે અને મંડળના આદેશ. સંબંધીનું *(દાતા ઉપરાંત)*
પણ. કામ કરી શકે અને તે અંગે જે કંઈ ખર્ચ ~~થાય તે તે~~.
સમાજના ઇતર કાર્યો અંગે જે ખર્ચ કરવા પડે તો તે ખર્ચ ખર્ચ *સમાજના પ્રમુખ ની*
શ્રી સમાજના. જનરલ ફંડમાંથી કરવાના. પુર્ણ સત્તા ~~શ્રી~~
મંત્રી શ્રી રતનશી ભાઈ પ્રેમજી અને
શ્રી. નથુભાઈ નાનજીને આપવામાં આવે છે

(૨). પ્રચાર માટે શ્રીયુત પ્રેમજી ભાઈઓ પ્રચારને માટે જ્યાં
જ્યાં પ્રચાર કરવા જાય, અને તે અંગે જે ખર્ચ થાય તે સ
માજના. જનરલ ફંડમાંથી કરવાનું નક્કી કરવામાં આવે છે.

(૩). સંવત. ૨૦૦૧ ના. આસો સુદ ૧૪ ને રોજ. વાંઢાય મુકામે ભરાયેલ
સભામાં ઠરાવવામાં આવેલ કે જુદા જુદા ગામમાં
રહેતા. સનાતની ભાઈઓના. ધણીઓ નક્કી કરેલ. જે કેમ
ઓછી થાય. તેનો નિકાલ કરી થશે પણ બીજું ના.
લેવાશે નહીં. કરી. અને પોતપોતાના ગામમાં પટેલ ધણીઓ
ના કુલ વાળાઓ આગેવાન દર સેંકડે ટકા. ૧૦ લેવા પ્રમાણે.
શાંતિ પંચે ... નામે સ્વ ખેડૂતાને મોકલી આપવા
અને તેના પરથી સમાજના. આગેવાનો. સોંપ્યા.

VSAK: 20-Oct-1945

realpatidar.com

https://archive.org/details/bk1053/page/n7/mode/1up

KJ- BK- 4- 20

realpatidar.com

ઉપર પ્રમાણે ઠેરાવ નકી થયો સકો તે મુજબ રકમ પાસેથી
લાનાગામના નકી કરા ને આપવા માટે અપીલ કરવામાં આવેછે

realpatidar.com